

Registered Office:

815, Nilamber Triumph, Gotri-Vasna Road, Vadodara - 390 007. Gujarat (INDIA).

Ph.: +91-265-2991021 / 2991022

Email: admin@pardrugs.com

CIN No.: L24117GJ1999PLC035512

www.pardrugs.com

PAR/CS/NSE/2021-22/34

To,

Date:09/09/2021

The Manager
Listing department,
National Stock Exch

National Stock Exchange of India Limited

Exchange Plaza, C-1, Block-G, Bandra Kurla Complex, Bandra (E), Mumbai- 400 051 Maharashtra

Subject: Newspaper Advertisement – Disclosure under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations")

Ref.: Symbol- PAR (NSE Emerge), ISIN: INE04LG01015

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 read with Schedule III Part A Para A of SEBI Listing Regulations, we enclose the copies of newspaper advertisement published in Newspaper dated September 09, 2021 in The Economic Times (English) and Navgujarat Samay (Gujarati), regarding 22nd AGM Notice and e-voting information for 22nd Annual General Meeting of the Company, in compliance with section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of SEBI Listing Regulations.

The above information is also available on the website of the Company www.pardrugs.com

Kindly take on the record and acknowledge the receipt

Yours Faithfully

For PAR DRUGS AND CHEMICALS LIMITED

(Sanket B. Trivedi)

Company Secretary & Compliance Officer



Focus BlueChip Eqty- 68.27 -0.10

10.05 -0.07

Ultra ST-WD

Bond Deposit 99A-QD 18.19

Equity Savings-QD FRIF ST-D

Medium Term -AD 19.26 0.00 Medium Term -G 19.26 0.00

Personal Finance

Value-G 10.23 -0.04 Value-IDCW 10.23 -0.04

Credit Opp-DD 1004.31 0.00 Credit Opp-G 2489.43 0.01

Equity-Savings-G 13.05 -0.05 Equity-D 20.86 -0.05 Equity-G 41.76 -0.05

NAV %CHG

Ultra Short Term-DD 10.01 0.00 Ultra Short Term-FD 10.10 0.01 Ultra Short Term-WD 10.09 0.08

day-on-day changes in your equity and balanced fund portfolio

Part	SCHEME NAV %CHG	FUNDS NAVS	SCHEME NAV %CHG	SCHEME NAV %CHG SCHE
MANDES 98 - 98 - 98 - 99 - 99 - 99 - 99 - 99		Equity-D 24.13 -0.12	Dynamic Equity-D 15.44 0.06	Value Fund-D 13.42 -0.12 ST In
AMERICAN 181 191	AAF Multi FoF D 20.61 -0.16	Fixed Income Opp-G 18:25 0:00	ELSS 96-B 77.45 0.22	World Agriculture-D 22.17 0.30 ST In
August	Active Debt Multi Mg 19.57 -0.02	Fixed Income Opp-WD 10.28 0.00 Floater A-IDCW 1006.75 -0.01	ELSS 96-G 77.45 0.22 Equity Savings-D 12.50 0.08	World Energy-D 15.15 0.03 Savin World Energy-G 16.80 0.03 Savin
Marging 1919 101	Advantage-G 721.38 -0.08	Floater M-IDCW 1003.17 -0.01	Gilt-D 30.49 -0.04	World Gold-G 18:28 0.84 Small
Section 1.5 1.	Bal Bhavishya Yojana 14.55 0.14 Balanced 95-D 271.90 0.02	Floater-G 1006.77 -0.01 Focused 25-D 41.13 -0.27	Growth-D 43.52 0.09 Growth-G 177.89 0.10	World Mining-G 14.92 -0.03 Taxsf Taxsf
SIGNAP 1.00 2.00	Balanced Adv-D 25.77 -0.08	Glob.Innovat.FDF-G 10.95 0.74	Large & Midcap-G 16.30 0.18	ASEAN Equity Off-sha 25.28 0.17 Tech
Gradation 1. 1. 2. 3. 3. 40	Banking & Fin. Ser D 25.97 -0.04	Global Equity Alpha- 13.14 0.22	Large Cap-G 23.53 0.04	Arbitrage-G 16.09 0.05 Treas
Company Comp	CEF Global Agri-D 18.35 0.45 CEF Global Agri-G 31.78 0.46	Gold-D 15.71 -0.38 Gold-G 15.70 -0.38	Liquid-G 2404.72 0.01 Liquid-WD 1218.54 0.05	Balanced Adv-G 38.68 -0.13 US 0 Balanced Adv-MD 24.17 -0.12 US 0
Carlot C	Cash Manager-G 565.19 0.00	Greater China Equity 9.08 0.44	MIP-MD 16.25 -0.06	Bank & PSU Debt-D 18.95 -0.04 Ultra
Carbane 18.2. 5.01. Sept. 19.2. 5.01. Sept. 19.2	Cash Plus-D 182.65 0.01 Cash Plus-DD 100.20 0.00	Growth Opp-G 21.31 -0.28 Income Saver-AD 14.44 -0.11	MidCap-D 17.65 0.23 MidCap-G 17.65 0.23	Bank & PSU Debt-MD 11.35 -0.04 Bank & PSU Debt-WD 10.61 -0.04 HD
Geber D. S. C. H. V. March S. M. J. C. J. V. Worldow S. D. L. S. J. W. Worldow S. J. W. Worldow S. J. W. Worldow S. D. L. S. J. W. Worldow S. J. W. World	Cash Plus-WD 100.26 0.01	Income Saver-HD 13.19 -0.11	Overnight-DO 1000.00 0.00	Bharat Bond FOF - Ap 11.46 -0.01 Arbit
College 1.1.	Corp Bond -D 11.75 -0.01 Corp Bond -G 16.75 -0.01	LT Equity-D 55.14 -0.21 LT Equity-G 81.80 -0.21	Overnight-WD 1000.12 -0.05 ST Bond-D 10.20 0.00	Bharat Bond FOF - Ap 11.69 - 0.08 Arbit Bharat Bond FOF - Ap 11.69 - 0.08 Arbit
SOLICH 100 641	Credit Risk S-Portfo 0.42 0.00	Liquid-G 2318.26 0.01	5T Bond-QD 11.16 0.00	Bharat Bond FOF 04-2 10.65 -0.05 Asset
Sement Sement 1967 1.0 100	Div. Yield Plus-D 33.53 -0.68	Liquid-WD 1002.17 0.01	Treasury Adv-G 1621.24 0.00	Bharat Bond FOF 04-2 10.49 -0.05 Bank
Section of the Col.	Dynamic Bond S-Portf 1.45 0.00 Dynamic Bond S-Portf 0.45 0.00	Midcap-G 76.06 -0.28 Money Market-AD 1126.88 0.01	Treasury Adv-QD 763.21 0.00 Treasury Adv-WD 730.63 0.00	Dynamic Bond-D 23.10 0.01 Bank Dynamic Bond-G 24.77 0.01 Capit
Communication 1.1.1 1.1.	Dynamic Bond S-Portf 0.43 0.00	Money Market-G 1126.71 0.01		Equity Savings-B 19.23 0.00 Cashl
Signature 13.5 20.0 10.0 20	Dynamic Bond-G 37.28 -0.02	Money Market-QD 1046.66 0.01 Multicap-D 16.72 -0.30	Balance-G 266.45 -0.05	Equity Savings-G 19.22 0.00 Cashl Equity Savings-MD 14.54 0.00 Cashl
Samesdand, 11-34 6-56. **PORTES*** OF PORTES*** OF PORTES** OF PORTES*** OF PORTES** OF POR	ESG Fund-D 13.15 -0.30	Nifty 100 Index-D 15.13 -0.13	Dynamic Bond-D 14.73 -0.08	GSec-G 20.46 -0.27 Cashi
Signature Sign	Enhanced Arbit D 11.24 0.04	Overnight-DO 1000.51 0.00	Emerging Equity-D 98.15 0.17	Government Securitie 20.38 -0.27 Cashi
SERVICE DISCUSSION STATE OF ST	Eq Saving Fund -D 15.68 0.00 Eq Saving Fund -G 18.84 0.00	Overnight-WD 1001.91 0.01 Overnight-WD 1000.78 0.01	Equity Diver-G 242.01 -0.05 Equity Diver-RD 73.66 -0.04	Gr China Equity Off- 54.98 1.26 Child LT Equity Tax Saving 28.62 -0.10 Core
The content of the	Equity-G 1242.62 -0.13	Quant Fund-IDCW 10.88 -0.37	Equity Taxsaver-G 122.87 -0.21	Large & MidCap-D 24.11 -0.25 Corp.
### 1950 20.00 20.	FRF LT-G 277.86 -0.01 FRF LT-WD 100.94 -0.01	Regular Savings-HD 11.91 -0.02 Regular Savings-QD 10.64 -0.02	FORCE-G 72.18 0.14 Focused Equity-G 12.06 0.17	Large Cap-D 30.94 -0.23 Corp. Large Cap-G 59.34 -0.22 Divid
Fig. Part March 201 2.51 1	FRF ST-G 292.40 0.01	Retire Savings - Agg 14.09 -0.21	Gilt PGS-G 64.00 -0.13	Liquid-AD 2694.45 0.01 Dyna
Signate Formal 1942 1.41	Fin Plan FoF Aggress 32.63 -0.21	Retire Savings - Dyn 14.16 - 0.21	Income-G 49.72 0.06	Liquid-DD 1002.96 0.00 Equit
Figure 1 Figure 2 Figure 3 Figure 3 Figure 4 Figure 5	Fin Plan FoF Conserv 16.92 -0.12 Fin Plan FoF Conserv 24.92 -0.12	Retire Savings-Conse 12.71 -0.26 Short Term-D 15.98 -0.01	Infrastructure-D 43.71 -0.25 Infrastructure-G 77.71 -0.24	Liquid-G 2694.46 0.01 Equit Liquid-MD 1005.44 0.01 Equit
Transfer Engine 1.512 1.522 1.	Fin Plan FoF Prudent 29.08 -0.17	Short Term-MD 10.06 -0.01 Short Term-WD 10.24 -0.01	Large Cap+ -G 45.95 -0.11	Maiden Opp 1-0 19.88 -0.02 FRIF
Good Committee (1921 - 202) Good Stand States (1921 - 202) From Park (1921 - 202) Good Stand States (1921 - 202) From Park (1921 - 202) Good Stand States (1921 - 202) From Park (1921 -	Frontline Equity-G 363.58 -0.25 Gilt Plus PF-G 68.57 -0.01	Small Cap-D 40.06 0.23 Small Cap-G 63.76 0.24	Liquid -DD 1005 50 0.00 Liquid -FD 1790 98 0.01	Mid Cap - D 41.28 - 0.22 FRIF Mid Cap - G 53.91 - 0.22 Gilt L
Gold and Earth 2013. 6.04. Fig. 1913. 6.04. Fi	Global Commodities-D 19.23 0.72	Special Situations-G 13.12 0.08	Liquid -MD 1001.13 0.01	Multi AAF-G 40.21 -0.10 Gold-
GREC 1911 GREE 1917 GREE 1	Global Real Estate-D 25.33 0.60	Treasury Adv-G 2535.07 0.00	MIP-G 82.16 0.04 MIP-MD 16.44 0.04	Multi Cap-G 24.52 -0.29 Grow
Internation	Gold-G 14.91 -0.80	Triple Adv-D 25.18 -0.19	Medium Term Opp D 12:30 -0:03	Overnight-AD 1082.39 0.01 High
	Income Plus-G 107.15 -0.05	Ultra ST-D 12:20 0:01	Overnight-DO 1001.00 0.00	Overnight-Fn0 1050.13 0.01 High Overnight-G 1082.16 0.01 High
mis defended. 143. 0.53	Index-0 17.92 -0.09 Index-G 173.35 -0.09	Ultra ST-G 12.19 0.01 Ultra ST-MD 10.04 0.01	Savings Plus-D 30.61 0.00 Savings Plus-DD 10.26 0.00	Overnight-MD 1058.61 0.01 High Overnight-WD 1064.87 -0.05 High
Information 6	India GenNext-G 148.29 0.25		Savings Plus-MD 10.28 0.00	
Interface 1.14 2.01 2.	Infrastructure-G 51.74 -0.06	Aqua FoF-G 11.05 0.28	Small Cap-D 20.90 -0.10 Small Cap-G 22.23 -0.09	ESSEL Incor
Mary Parish Sci. 33.6 D.B. Cop Bord 23.2 OST Temper Rev ID 101,17 OST Early Herodo 142 OST	Inthi Eqty A-G 32.63 0.56 Inthi Eqty B-0 21.86 0.01	Balanced-0 16.85 -0.40 Balanced-G 19.67 -0.40	Treasury Adv-DD 1240.71 0.00	3in1-G 27.76 -0.36 Index 3in1-MD 23.30 -0.36 Index
Michael Mich	MIP2 Wealth25-G 53.45 0.36	Corp Bond-G 23.20 -0.01	Treasury Adv-MD 1001.27 0.01	Equity Hybrid-AD 14:87 -0.02 Infra
Mount Person 1975	MNC-D 361.68 0.03 MNC-G 1066.49 0.03	Corp Bond-QD 10.82 -0.01 Div Yield-D 23.79 -0.18	Value-G 10.00 0.00 Value-IDCW 10.00 0.00	Equity Hybrid-G 14.91 -0.02 LT Ac Equity Hybrid-HD 14.87 -0.02 Large
Mobile Ten 1.0 1	Medium Term S-Portfo 0,62 0,00	Dynamic Equity-AD 14.16 -0.04	Yield Adv-MD 16.96 -0.02	Equity Hybrid-QD 14.87 -0.02 Liqui
Medium Press (C. 1922 - 1938) Eshwared Arbothase 1,34, 2,06 1,000 1,	Medium Term S-Portfo 0.81 0.00	Dynamic Equity-MD 13.57 -0.04		Large & Midcap-D 25.66 -0.14 Liqui
Information 1.557	Medium Term-HD 11.05 -0.03	Enhanced Arbitrage 13.26 0.05	10YR G-Sec -G 18:00 -0:19	Large & Midcap-HD 25.60 -0.14 MIP L Large Cap Equity-AD 27.05 -0.15 MIP L
Miles Co.	Mfg. Equity-D 15.67 0.13	Enhanced Arbitrage - 10.57 0.06	10YR G-Sec -QO 10.71 -0.19	LargeCap Equity-G 38.71 -0.15 Medi
Maint Cap Dist 12.00 Pless Debt + 10.00 0.00 Amir Allocomo 1.27 0.04 Loudy #M. 10022.5 0.01	MidCap-D 67.40 -0.13 MidCap-G 482.94 0.14	Equity-G 153.22 -0.25 Flexi Debt-DD 10.11 0.00	Arbitrage-G 12.23 0.03 Arbitrage-MD 11.05 0.03	LargeCap Equity-QD 24.88 -0.15 Medi Liquid-IDD 1001.29 0.00 MidC
Size Millerum C. 1422 548 Pies Debt OD 1058 0.00	Multi-Cap-IDCW 12.22 0.00	Flexi Debt-HD 10.00 0.00	Asset Allocation-G 21.77 0.04	Liquid-MD 1002.25 0.01 Multi
Information 18 18 19 19 19 19 19 19	New Millennium-G 142.20 -0.68	Flexi Debt-QD 10.58 0.00 Flexi Debt-WD 10.11 0.00	Banking & PSU Debt-D 10.16 -0.02 Banking & PSU Debt-G 19.67 -0.02	Long Term Adv - 0 21.84 - 0.33 NIFT Long Term Adv - G 22.08 - 0.33 Prem
Selection Part Pa	Nifty Smallcap50-G 12.85 -0.19	Focused 25 Equity-G 15.38 0.01	Banking & PSU Debt-Q 10.29 -0.02	Multi Cap-D 16.59 -0.15 Retin
Committed 100, 100, 100, 100, 100, 100, 100, 100	Nifty50 EQL.Weight-G 10.84 -0.24	India Consumption-G 20.32 0.39	Band-G 68.18 0.02	Multi Cap-HD 16.59 -0.15 Retin
Ownering Mo. 1000 100 101 102 102 102 102 102 103 103 103 100 103 100 103 100 103	Overnight Fund-G 1128.44 0.01	MIP-G 39.98 -0.06	Corp Bond-D 11.30 0.01	Nifty50-G 10.92 -0.09 ST 0p
Pill English C	Overnight-MD 1000.93 0.01	MIP-QD 12.57 -0.06	Corp Bond-MD 10.43 0.00	Regular Savings-MD 11.42 0.05 Small
Part Value 0	PSU Equity-G 13.59 -0.37 Pharma & Healthcare 18.95 -0.68	Medium Term Income-G16.05 0.01 Medium Term Income-H10.00 0.00	Credit Risk-D 11.67 0.02 Credit Risk-DD 10.25 0.00	Ultra ST-DD 1006.72 0.00 TaxS: Ultra ST-G 2343.36 0.02 Top 2
Retrement 30	Pure Value-0 54.68 -0.50	Medium Term Income-Q10.00 0.00	Credit Risk-MD 10.62 0.02	
Retrement 50 Plane J. 1168 0.07	Retirement 30-D 14.02 0.11 Retirement 30-G 14.03 0.10	MidCap-G 64.79 0.26 Money Plus-DD 10.08 0.00	Credit Risk-WD 10.26 0.02 Equal Nifty 50-D 15.55 0.24	FRANKLIN TEMPLETON Ultra Asian Equity-D 17.27 0.14
Returnent 50 Plant C. 11.68 - 0.07	Retirement 40-G 13.73 0.07	Maney Plus-MD 10.00 0.00	Equity & Bond-D 55.29 -0.04	Balanced-D 29.63 -0.19
Retrement 50 G	Retirement 50 Plus-G 11.68 -0.07	Overnight-DO 1001.32 0.00	Equity Opportunities 90.11 -0.29	Banking & PSU Debt-D 11.12 -0.05
Stropped 10053	Retirement 50-G 11.90 -0.07 ST Opportunities-D 16.80 0.00	Overnight-G 3213.98 0.01 Overnight-G 1098.15 0.01	Equity Savings -G 17.44 0.13	Bluechip-G 748.28 -0.35
Simines (Co. 1435.57	ST Opportunities-QD 11.13 0.00	Overnight-WD 1000.64 0.01	Equity Savings -QO 15.23 0.12	Build India-G 68.33 -0.54
Short Term 12.56 - 0.01	Savings-G 435.57 0.01 Savings-WD 100.70 0.01	ST Income-DD 10.03 0.00 ST Income-G 26.53 0.00	Equity-G 71.91 -0.06 Floater-D 10.35 -0.07	Cash Migmt-G 34.01 -0.01 Corp Bond Oppor-D 12.41 0.00
Small A Midrage D	Short Term-G 89.40 -0.01	ST Income-QD 10.85 0.00	Focus 25-D 37.65 -0.21	Dynamic Accrual-G 77.62 0.01
Special Disposition 15.66 0.09	Small & Midcap-D 53.97 -0.15 Small & Midcap-G 58.94 -0.15	BOI AXA	GSec-G 78.90 -0.15 GSec-MD 10.80 -0.15	Dynamic PE FOF-D 41.94 -0.07 Dynamic PE FOF-G 113.32 -0.07
Tax Pale 18.1	Special Opportunity- 15.64 0.00	Arbitrage Fund-G 11.61 0.06	Global Allocation-D 17.06 0.19	Equity Income-G 81.24 -0.43
Take C	Tax Relief 96-G 45.78 0.13	Arbitrage Fund QD 11.04 0.06	Healthcare-D 22.39 -0.50	Equity Saving-G 13.14 -0.15 Equity Saving-MD 12.54 -0.15
Treasury Optimizer © 1948 JO	Tax-G 55.74 0.16 Top 100-D 46.21 0.18	Bluechip-IDCW 11.13 -0.27 Conservative Hybrid 10.91 -0.07	Liquidity-DD 1000.93 0.00 Liquidity-G 2984.06 0.01	Equity Saving: QD 12.44 -0.15 European Growth-D 11.18 0.66
Teasury Optimizer-M 115.18 0.01	Treasury Optimizer-D 144.00 -0.01	Conservative Hybrid- 10.66 -0.07	Low Duration-DD 10.13 0.00	FlexiCap-D 21.05 -0.43
AVIVALIFE Large & MidCap Court 5.13 0.19 MidCap D 5.115 0.15 Crowth D 402.45 0.21	Treasury Optimizer-M 115.18 -0.01	Credit Risk-G 4.36 0.01 Equity Debt Rebal-D 10.38 0.21	Low Duration-MD 11.57 0.00 Low Duration-QD 10.66 0.00	GSet LT-G 52.03 -0.17 GSet LT-QD 11.64 -0.17
All Seasons Debt FOF 11.41 0.00 Lerge & MidCap Equit 6.57 - 0.18 Money Manager D. 107.05 0.01 High Growth Cets G. 69.52 - 0.48 Missanson Debt FOF 11.41 0.00 Liquid D0 1002.65 0.00 Money Manager G. 2002.18 0.01 Income Builder A.4D 13.77 - 0.03 Money Manager G. 2002.18 0.01 Income Builder A.4D 13.77 - 0.03 Money Manager G. 2002.18 0.01 Income Builder A.4D 13.77 - 0.03 Money Manager MD 1062.73 0.01 Income Builder A.4D 13.77 - 0.03 Money Manager MD 1062.73 0.01 Income Builder A.4D 13.75 0.03 Money Manager MD 1062.73 0.01 Income Builder A.4D 13.75 0.03 Money Manager MD 1062.73 0.01 Income Builder A.4D 13.75 0.03 Money Manager MD 1062.73 0.01 Income Builder A.4D 13.75 0.03 Money Manager MD 1062.73 0.01 Income Builder A.4D 13.75 0.03 Money Manager MD 1062.73 0.01 Income Builder A.4D 13.75 0.03 Money		Large & MicKap Equit 31.31 -0.19	Midcap-D 61.15 -0.15	Growth-D 402.45 -0.21
ALS Seasons Debt FGF 11.41 0.00 Liquid- D0 1002.65 0.00 Money Manager G 290.218 0.01 Income Builder A-B 15.69 0.03	All Seasons Debt FOF 11.41 0.00	Large & MidCap Equit 60.57 -0.18	Money Manager-D 1107.06 0.01	High Growth Cos-G 69.52 -0.48
AXIS SAME AS IN THE SAME AS A SAME AS INVESTIGATED A 28.63 0.28 Nat Res New Energy D 27.73 0.02 Income Builder AQD 14.50 -0.03 A INSTANCE AND A SAME AS A SAME A SAME AS A SAME	All Seasons Debt FOF 11.41 0.00	Liquid-DD 1002.65 0.00 Liquid-G 2400.93 0.01	Money Manager-G 2902.18 0.01 Money Manager-MD 1062.73 0.01	Income Builder A-G 83.92 -0.03 Income Builder A-HD 15.69 -0.03
Banking A PSU Debc D1031 12 0.00 Mrd & Infra-00 29 82 0.27 Nifty SD-0 16.35 0.09 Income Gpoortv-G 25 91 0.05		Mfg & Infra-D 28.63 0.28	Nat.Res.New Energy-D 27.73 0.02	Income Builder A-QD 14.50 -0.03
Banking A PSU Debt (N) 208.19 0.00 Multi Cap O 16.53 0.06 Miffy Next 50 G 16.35 0.34 L5 F0 70 - D 26.74 - 0.20	Banking & PSU Debt-D1039.12 0.00	Mfg & Infra-QD 29.82 0.27	Nifty 50-D 16.35 -0.09 Nifty 50-G 16.35 -0.09	Income Opportu-G 25.91 0.05 LS FOF 20-D 36.82 -0.27
Childrens Gift Locki 1	Banking & PSU Debt-M1034.67 0.00 Banking & PSU Debt-W1038.19 0.00	Mid & Small Cap Eqty 23.61 -0.08 Multi Cap-D 16.53 -0.06	Nifty Next 50-D 16.35 -0.34 Nifty Next 50-G 16.35 -0.34	LS FOF 20-G 120.94 -0.27 LS FOF 30-D 26.74 -0.20
Chickens Gift No. 10. 22. 05	Childrens Gift Locki 21.80 0.13	Overnight-G 1055.46 0.01	Overnight Fund-G 1117.37 0.01	LS FQF 40-D 15.53 -0.14
Constant Maturity 10 1120 0.10 ST Income MD 9.04 -0.04 Reg Savings-MD 1359 0.01 L5 F0F 50-D 12.38 -0.08 Contract Maturity 10 1125 o.10 ST Income QD 8.57 -0.03 Reg Savings-MD 1359 0.01 L5 F0F 50-D 27.84 -0.08 Contract Maturity 10 1125 o.01 ST Income QD 8.57 -0.03 Reg Savings-MD 1359 0.01 L5 F0F 50-D 27.84 -0.08 Contract Maturity 10 12.0	Childrens Gift No Lo 22.05 0.13 Constant Maturity 10 10.10 0.10	Overnight-W-IDCW 1000.08 0.01 ST Income-G 18.60 -0.04	Quant-D 17.40 -0.06 Quant-G 17.40 -0.06	LS FOF 50 +FR-G 47.69 -0.05 LS FOF 50 +FR-QD 15.20 -0.05
Corp Debt Opp - 00 10.23 -0.01 Tax Adv1-0 4.49 0.16 5T-MD 11.51 -0.02 Lmv Duration-MD 11.48 0.04 Corp Debt Opp - MD 10.22 -0.01 Tax Adv1-0 4.49 0.16 5T-MD 11.51 -0.02 Lmv Duration-MD 11.48 0.04 Corp Debt Opp - MD 10.22 -0.01 Tax Adv1-0 11.25 -0.15 -0.10 Corp Debt Opp - MD 10.22 -0.01 Tax Adv1-0 11.25 -0.15 -0.10	Constant Maturity 10 21.20 -0.10 Constant Maturity 10 11.25 -0.10	ST Income-MD 9.04 -0.04 ST Income-QD 8.57 -0.03	Reg Savings-G 48.13 0.01 Reg Savings-MD 13.59 0.01	LS FOF 50-D 12.38 -0.08 LS FOF 50-G 37.48 -0.08
Comp Debt Ope-MD 10.22 -0.01	Corp Debt Opp-DO 10.23 -0.01	Small Cap-G 25.64 0.12	ST-G 39.89 -0.02	Low Duration-MD 11.48 0.04
Dynamic Bond - HD 12.13 0.00 Ultra ST-DD 1011.93 0.00 Savings-D 12.29 0.01 MiP - QD 14.05 0.10	Corp Debt Opp-MD 10.22 -0.01 Corp Debt Opp-WD 10.36 -0.01	Tax Advt-G 112.54 -0.15 Ultra ST-B 2596.35 0.01	ST-QD 12.15 -0.02 ST-WD 10.19 -0.02	MIP -G 72.24 -0.10 MIP -MD 14.67 -0.10
Dynamic Equity/0 13.36 0.07 BARODA PIONEER Savings-MD 10.80 0.01 MSE kifty/0 14.205 0.08	Dynamic Bond - HD 12.13 0.00 Dynamic Bond - G 25.62 0.00	Ultra ST-DD 1011.93 0.00 Ultra ST-G 2609.47 0.01	Savings-D 12.29 0.01 Savings-DD 10.15 0.00	MIP -QD 14.05 -0.10 Multi Asset Solution 15.06 -0.21
ESG Equity 0 16.92 0.00 Balance-0 23.12 0.22 SmallGa-G 107.60 -0.09 Coportunities-D 28.14 -0.64 Enhanced Arbitrage 0 15.90 0.00 Balance-G 89.34 0.18 Strategit Bend-DD 1047.95 -0.10 Opportunities-G 125.26 0.64 Enhanced Arbitrage 0 11.50 0.03 Banking 8 Fin-D 19.97 -0.05 Strategit Bend-MD 1069.05 -0.00 Description D 1000.00 0.00 Enhanced Arbitrage 4 15.76 0.03 Banking 8 Fin-D 31.28 -0.10 Strategit Bend-MD 1069.05 -0.00 0.00	Dynamic Equity-D 13.36 -0.07		Savings-MD 10.80 0.01 SmallCap-D 46.25 0.09	NSE Nifty-D 142.05 -0.08 NSE Nifty-G 142.05 -0.08
Enhanced Arbitrage G. 1576 D. 0.3 Banking & Fin-G. 31.28 O. 10. Strategic Bond-MD. 1069.65 - 0.10 Quernight-M. 0. 00.13 D. 0.11 Equity Hybrid-G. 16.24 0.25 Banking & FSUB Bond-G. 10.33 - 0.0.1 Strategic Bond-MD. 108.95 Ta. 0.10 Quernight-MD. 100.01.60.01 Equity Hybrid-G. 16.24 0.25 Banking & FSUB Bond-M. 10.33 - 0.0.1 Strategic Bond-MD. 105.97 Ta. 0.1.0 Pension. 0. 19.79 - 0.1.4 Equity Hybrid-MD. 15.51 - 0.26 Banking & FSUB Bond-M. 10.33 - 0.0.1 HIGER-D. 33.89 0.15 Pension. 0. 19.79 - 0.1.4 Equity Hybrid-MD. 15.50 - 0.19 (RF B-MD. 11.77 - 0.01 HIGER-G. 18.22 - 0.55 Prima - D. 83.22 - 0.42 Equity Saver-D. 14.23 - 0.07 (RF B-MD. 11.77 - 0.01 Tax Saver-D. 58.80 - 0.28 Prima - D. 165.78 - 0.42 Equity Saver-D. 18.20 - 0.05 (RF B-MD. 11.77 - 0.01 Tax Saver-D. 58.60 - 0.28 Prima - P. 58.59 - 0.38	ESG Equity-D 16.92 0.00 ESG Equity-G 16.92 0.00	Balance-D 23.12 0.22 Balance-G 89.34 0.18	SmallCap-G 107.60 -0.09 Strategic Bond-DD 1047.95 -0.10	Opportunities-D 28.14 -0.64 Opportunities-G 125.26 -0.64
Equity Hybrid O 16.24 0.25 Banking & PSU Bond M 10.33 -0.01 Strategic Bond-WD 10.571 -0.10 Pension O 19.79 -0.14 Equity Hybrid OD 15.51 0.19 CRE B-G 17.12 -0.01 TICER-D 33.89 0.15 Pension G 16.93 -0.14 Equity Saver O 14.23 -0.07 CRE B-MD 11.77 -0.01 Tax Saver O 58.80 -0.28 Prima -D 83.22 -0.42 Equity Saver G 18.20 -0.05 CRE B-QD 11.77 -0.01 Tax Saver O 8.862 -0.28 Prima -PU-S 53.99 -0.18	Enhanced Arbitrage-G 15.76 0.03	Banking & Fin-G 31.28 -0.10	Strategic Bond-MD 1069.65 -0.10	Overnight-G 1090.13 0.01
Equity Saver G 18.20 -0.05 (RF 8-0 11.17 -0.01 TIGER-G 18.8.24 -0.15 Prima -D 8.3.22 -0.4.2 Equity Saver G 18.20 -0.05 (RF 8-0D 11.77 -0.01 Tax Saver D 58.8.0 -0.28 Prima -G 1645.78 -0.42 Equity Saver G 18.20 -0.05 (RF 8-0D 11.77 -0.01 Tax Saver G 8652 -0.28 Prima Plus D 53.99 -0.18	Equity Hybrid-G 16.24 0.25 Equity Hybrid-MD 15.21 0.26	Banking & PSU Bond-M 10.33 -0.01 Banking & PSU Bond-Q 10.23 -0.01	Strategic Bond-WD 1056.71 -0.10 TIGER-D 33.89 0.15	Pension-D 19.79 -0.14 Pension-G 169.39 -0.14
	Equity Hybrid-QD 15.69 -0.19 Equity Saver-D 14.23 -0.07	CRF B-G 17.12 -0.01 CRF B-MD 11.77 -0.01	TIGER-G 148.24 0.15 Tax Saver-D 58.80 0.28	Prima - D 83.22 - 0.42 Prima - G 1645.78 - 0.42
менту жиза при делу чин мунина мина и жиза чина примещину и 20.72 ч.10 мина мина и 389.69 ч.18	Equity Saver-G 18.20 -0.05 Equity Saver-MD 13.77 0.00	Dynamic Bond-D 14.58 -0.05	Tax Saver-G 86.62 -0.28 Top100 Equity-D 26.72 -0.16	Prima Plus-G 989.69 -0.18 Prima Plus-G 989.69 -0.18



GUJARAT INTERNATIONAL FINANCE TEC-CITY COMPANY LIMITED (GIFTCL)

Notice for Invitation to submit the sealed Bid for Selection of Developer

Gujarat International Finance Tec-City Company Limited (GIFTCL) invite bids from reputed, qualified, experienced and financially sound Developers for the following Project:

Name of Project	Duration for Completion of Project	Availability of Bid Document	Bid Due Date
Development of Central Green Park in GIFT City (RFP Reference No.: GIFT/PAE/RFP/CP/2021/01)	Maximum 05 (Five) Years	09th September 2021 to 08th November 2021 upto 17:00 Hrs	09th November 2021 upto 15:00 hrs

Bid document may be downloaded online from website at www.giftgujarat.in

Tender fee of Bid document is Rs. 10,000/- payable in the form of Demand Draft / Banker's Cheque / Pay Order from any Nationalized / Scheduled Bank drawn in favor of "Gujarat International Finance Tec-City Company Limited" payable at Ahmedabad. For further details, RFP document and undates please log on to our Website www giftgujarat in

Contact Person: Vice President (PA&E)

Tel: 079-61708300 E-mail: contract@giftgujarat.in

Sd/-Managing Director & Group CEO

GUJARAT INTERNATIONAL FINANCE TEC-CITY COMPANY LIMITED EPS- Building No.49A, Block 49, Zone 04, Gyan Marg, GIFT City, Gujarat, INDIA. Pin-382355. Tel.: +91 79 61708300 Fax.: +91 79 30018321 CIN:U65929GJ2007PLC051160

Focused Equity-G 16.21
Infra Equity-O 22.75
Infra Equity-O 22.75
Infra Equity-O 26.89
Large & Mid Cap Equi 16.49
Large & Mid Cap Equi 16.51
LargeCap Equity-O 40.40
LargeCap Equity-O 340.36 Long Term-D Long Term-G Long Term-QD king & PSU Debt-G 18.79 0.00 ital Builder-D 32.14 -0.43 ital Builder-G 455.04 -0.43 Long Term-WD MIP 25-G MIP 25-HD MIP 25-MD 101.42 300.44 Money Market MD 100.09
Money Market WD 100.77
MolhiCap-D 41.53
MultiCap-G 473.88
Nifty Index-D 23.59
Nifty Index-G 175.44
Nifty LowVol30 FOF-G 11.94
Nifty LowVol30 FOF-F 11.94
 Arbitrage Plus-G
 26.31

 Arbitrage Plus-MD
 15.19

 Arbitrage-AD
 11.98

 Arbitrage-G
 27.31

 Arbitrage-G
 27.31
 Ultra ST-WD Regular Savings-HD 11.18 Regular Savings-QO 11.57 Dynamic Bond -G 18.34 -0.02 Dynamic Bond -MD 12.77 -0.02 Growth-D 31.83 -0.40 Growth-G 32.16 -0.40 Balanced -D ITI ASSET MANAGEMENT | Constant Mar Gill-0 | 11.19 | 0.20 | Corporate Bond | 37.60 | 0.05 | Corporate Bond | 40 | 14.64 | 0.05 | Corporate Bond | 10 | 14.64 | 0.05 | Corporate Bond | 10 | 11.14 | 0.05 | Dividend Yield Equit | 1.03 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 | Bond LT-G Bond LT-PD Dynamic Bond-Q-IDCW 10.13 | Reside Income FD | 101.72 | 0.01 |
Reside Income FD	101.72	0.01
Reside Income FD	101.72	0.01
Reside Income FD	106.74	0.01
Reside Income WD	105.47	0.10
Reside Income WD	105.47	0.10
Reside Income WD	105.47	0.10
Reside Income WD	105.47	0.10
Reside Income WD	105.47	0.10
Reside Income WD	105.47	0.10
Reside Income WD	105.47	0.10
Reside Income WD	105.47	0.10
Reside Income WD	105.47	0.10
Reside Income WD	105.47	0.10
Reside Income WD	105.47	0.10
Reside Income WD	105.47	0.10
Reside Income WD	105.47	0.10
Reside Income WD	105.47	0.10
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside Income WD	105.47	0.01
Reside In 23.82 -0.38 75.42 -0.36 10.47 -0.05		

NOTICE

NOTICE is hereby given that the Certificate(s) for NAVIN FLUORINE INTERNATIONAL LIMITED has/have been lost or mislaid and undersigned has/have applied of the Company to issue duplicate Certificate(s). Any person who has a claim in respect of the said securities should lodge such claim with the Company at its Registered Office within 15 days from this date else the Company will proceed to issue duplicate

Folio No	Name of the Shareholder(s)	Face Value		Distinctive Nos.	No. of Shares
11017525	KIRTIVADHAN CHHOTABHAI PATEL RANJANBEN KIRTIVADHAN PATEL	2	595279	49195276 - 49195300	25
	Nadiad 7/9/2021		KIRT RAN 11, 8	e & Address of Shai TVADHAN CHHOTAI JANBEN KIRTIVADI Ihagirath Society, No larnagar, Nadiad 387	BHAI PATÈL HAN PATÈL HAT



STEEL & INDUSTRIAL

Aunani P.O., Thrissur – 689 581, Kera Ph: 0487-2201362, 2201736, Mob: 9400000 E-mail: sifiprojectsdept@gmail.com SIFLPROJECT/MDN/21 7.9 202

Competitive Tenders are invited for erection and commissioning of the following machinery. For more details please visit the

E-Tendering Portal https://letenders.kerala. gov.in or www.siflindia.com 1) 6T capacity open forging hammer 2) Gas/Oil furnace 3) 3 axis CNC machine 4) Screw compressor 1026 CFM (Sd/-) MANAGING DIRECTOR

Par Drugs And Chemicals Limited (Erstwhile Par Drugs And Chemicals Private Limited) CIN: L24117GJ1999PLC035512 Registered office: 815, Nilamber Triumph, Gotri Vasna Road, Vadodara-390007, Gujarat, India Phone no.: 0265-2991021, 0278-2447013

Website: www.pardrugs.com Email: investors@pardrugs.com NOTICE OF 22nd ANNUAL GENERAL MEETING & E-VOTING INFROMATION

Notice is hereby given that the 22"d Annual General Meeting (AGM) of the Company will be held on Wednesday, 29th Day of September, 2021 at 4:00 P.M IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the business, asset out in the Notice of AGM. The Company has sent the AGM Notice & Annual Report on September 6, 2021through electronic mode to the members whose email addresses are registered with the Company/Depositories/Share Transfer Agent in accordance with circular issued by Ministry of Corporate Affairs, dated May 5, 2020; dated April 8, 2020; dated April 13, 2020 [Collectively hereinafter referred as "MCA Circulars"] and SEBI Circular dated May 12, 2020. The Annual Report with AGM notice can be downloaded from the Company's website www.pardrugs.com, website of the National Stock Exchange of India Limited at www.nseindia.com and website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com

Pursuant to provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations 2015, the members are provided electronic Voting ["e-voting"] facility provided by NSDL before and during the AGM according to schedule given in the notice of AGM to cast their votes on all resolutions set out in the Notice of the AGM. The voting rights of the members shall be in proportion to equity shares held by them in the paid up equity share capital of Company as on Tuesday, September 21, 2021.("Cut-off date").

The remote e-voting period begins on Friday, September 24, 2021 at 09:00 A.M. IST and ends on Tuesday, September 28, 2021 at 05:00 P.M. IST. during this period shareholders of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e on Tuesday, September 21, 2021 may cast their vote electronically. The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. Only those shareholders, who are present in the AGM through VC/OAVM facility and have not casted their vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system available during the AGM. The Shareholders who have voted through Remote e-Votingprior to AGM, may attend/participate but they will not be entitled to vote during

Any person, who acquires shares and becomes member of the company after dispatch of AGM notice and hold shares as on cut-off date; may obtain the credentials by sending a request to evoting@nsdl.co.in However, if he/she is already registered with NSDL for remote e-voting, then he/she can use the existing credentials forcasting votes.

Further, if you have not registered your email address with the Company/Depositories/Share Transfer Agent, you may follow the instructions given in the AGM Notice.

In case, any member have any queries regarding e-voting can refer instruction of e-voting mentioned in AGM Notice of the Company. Though, Individual Shareholders holding securities in demat mode facing any technical issues related to login through Depository i.e. NSDL and CDSL, can contact :-(i) NSDL helpdesk by sending a request at evoting@nsdl.co.in or call at toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 And; (ii) CDSL helpdesk by sending a request at helpdesk.evoting@cdslindia.com or contact at 022- 23058738 or 022-23058542-43

The details of AGM are available on website of company at www.pardrugs.com; website of NSDL at evoting@nsdl.co.in and website of NSE at www.nseindia.com.

Date: 09/09/2021 Place: Vadodara

For Par Drugs And Chemicals Limited Sd/-Sanket B. Trivedi Company Secretary & Compliance Officer



lanced-D 41.25 -0.12 lanced-G 74.82 -0.12 lanced-HB Principa 76.59 -0.12

NOTICE OF 115th ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 115th Annual General Meeting of the Members of the Bank will be held at NMIMS, Mukesh Patel Auditorium, Navyug Society, Navpada, JVPD Scheme, Opp. Mithibai College, Vile Parle West, Mumbai - 400 056 on Thursday 30th September 2021, at 2.30 p.m. to transact the following business:-

- 1. Adoption of Annual Report with Audited Balance Sheet as at March 31 2021 and the Profit and Loss Account for the year ended March 31, 2021.

 2. Declaration of Dividend and Allocation of Profits for the Financial Year
- 2020-2021. Consideration of Statutory Audit Report from M/s Mukund M. Chitale
- Chartered Accountants, with compliance report thereto, for the Financial Year 2020-2021.
- . Ratification for the appointment of New Managing Director Appointment of Joint Statutory Auditors for the Financial Year 2021-2022 and to authorize the Board to approve their remuneration.
- Review the list of employees who are relatives of members of the Board or of the Managing Director.
- 7. To grant leave of absence to those members of the Bank who have not
- attended this Annual General Meeting. 8. Amendments to Bye-Laws. 9. Disposal of any other business that may be brought before the meeting and
- responding to Members' questions, relating to the working of the Bank during the Financial Year 2020-2021, permissible under the Bank's Bye-Laws and Rules and in respect of which at least 8 days' notice, in writing, has been furnished to the Managing Director, at the Bank's Registered Office.

Note: If within half an hour after the time appointed for the meeting, the quorum is not formed, the meeting would stand adjourned and this adjourned meeting shall be held either on the same day or on such other date at the time and place as may be decided by the Chairman or the member presiding over the meeting in his absence. At such adjourned meeting, the business before it may be transacted notwithstanding the fact that there is no quorum.

Further, it is to be noted that Covid-19 guidelines as issued by the State Government of Maharashtra / Statutory Authority from time to time will be applicable on the day of Annual General Meeting

BY ORDER OF THE BOARD OF DIRECTORS

Ajit E. Venugopalar Managing Director

Date: 30.08.2021

IMPORTANT INFORMATION FOR MEMBERS Please download Annual Report from www.svcbank.com/AGM115.pdf egistered Office: SVC Tower, Jawaharlal Nehru Road, Vakola, Santacruz (E), Mumbal - 400 055.



VERA SYNTHETIC LIMITED CIN: L17110GJ2000PLC037369

Read. Office: Office No. UL-27, Pattani Plaza, Devubaug, Dairy Road, Bhavnagar GJ 364002 IN Phone No.:+91 0278 2525434 Email ID: cs@sujlonropes.com Website: www.sujlonropes.com

NOTICE OF 22^{10} AGM AND BOOK CLOSURE Notice is hereby given that the 22nd Annual General

Meeting of the Members of Vera Synthetic Limited is scheduled to be held on Thursday, the 30th Day of September, 2021 at 11:00 A.M.at Office No. UL-27, Pattani Plaza, Devubaug, Dairy Road, Bhavnagar GJ 364002 IN.

The 22nd Annual General Meeting of the Company will be held in compliance with the provisions of the Companies Act, 2013 and rules made thereunder, Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015 and circular number SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12.05.2020 issued by SEBI and covid-19 guidelines issued by the Government of India.

In terms of above mentioned circular, Companies are permitted to dispatch the Notice of the AGM along with the Annual Report FY 2020-21 through electronic mode to all the members whose email addresses are registered with the company/Depositaries. The same is available on the Company's website at https://www.sujlonropes.com/ The notice can also be accessed from the website of stock exchange i.e. National Stock Exchange of India Limited at www.nseindia.com

Notice is further given that pursuant to the provisions of the Section 91 of the Companies Act, 2013 and in accordance with the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members & Share Transfer Books of the Company will remain closed from Thursday 23.09.2021 to Thursday 30.09.2021 (both days inclusive) for the purpose of 22nd AGM.

A member can vote at the AGM. Persons entitled to attend and vote at the meeting, may vote in person or by proxy/ through authorized representative, provided that all proxies in the prescribed form/ authorization duly signed by the person entitled to attend and vote at the meeting are deposited at the Registered office of the Company, not later than 48 hours

Place: Bhavnagar Date: 07.09.2021

before the meeting.

For, Vera Synthetic Limited Kruti Shah **Company Secretary**

ઉના-ગીરગઢડા છ ઇંચ, બાબરા પાંચ ઇંચ, ગાંડલમાં પાંચ ઇંચ, જુનાગઢ ચાર ઇંચ, ભાવનગરમાં ચાર ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાનાં મંડાણ

નવગુજરાત સમય > ટીમ ગુજરાત

સમગ્રસૌરાષ્ટમાં મેઘરાજા ગાજવીજ સાથે મનમુકીને વરસી રહ્યા છે. જેમાં જુનાગઢ -માણાવદર-વિસાવદરમાં ચાર ઈંચ વરસાદ વરસાદ વરસતા બાંટવાના ખારા ડેમના 2 દરવાજા ખોલવામા આવ્યા છે. બાબરામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, તો ખાંભામાં 101 મીમી, ધારીમાં 77 મીમી, લાઠીમાં 56 મીમી વરસાદ વરસ્યો છે. અમરેલીના રાજલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થતા 6 દરવાજા ખોલાયા અમરેલી ઠેબી ડેમનો 1 દરવાજો ખોલાયો હતો. ઉના અને ગીરગઢડાના પંથકમાં ૬ ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરપાયા હતા. તો રાજકોટમાં પંદર મિનીટમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગોંડલ પંથકમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર થતા વાસાવડની નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. સાવરકુંડલા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.ભાવનગર જિલ્લામાં ચાર આવ્યું હતું. ઇંચ સધી વરસાદ વરસતા પાલિતાણા પાસેના ખારા ડેમના 10 દરવાજા ખોલાયા હતા. તો કચ્છના માંડવીમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, દોઢ ઈંચ



વરસાદના કારણે રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા.

જુનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં 1 ઇંચથી લઇને 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અમરેલીના બાબરામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, તો ખાંભામાં 101 મીમી, ધારીમાં 77 મીમી, લાઠીમાં 56 મીમી વરસાદ

ઉના ગીરગઢડા પંથકમાં ૨ થી ૬ ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં સાંજના સુમારે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની ઇનિંગ શરૂ

થઈ હતી. જ્યાં 15 મિનિટમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ગોંડલ પંથક સહિત વાસાવડ ગામે

5 ઇંચ વરસાદ વરસતા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ખોડિયાર નગરના વોકળામાં આંખે આખી કાર ફસાઈ ગઈ હતી. જસદણ પંથકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યા વરસ્યો છે. લાઠીના શેખપીપરીયામાં 4 બાદ બપોર બાદ પણ ધોધમાર વરસાદ ઈંચ વરસાદથી ગાગડીયા નદીમાં પુર વરસ્યો હતો. કચ્છના માંડવીમાં દોઢ ઈંચ જેટલો વરસાદ થતાં શહેર અને જોશભેર પાણી વહી નીકળ્યા હતા.

> ભાવનગરના વલ્લભીપરમાં 87 મીમી, ઉમરાળામાં 82 મીમી, સિહોરમાં

ગારીયાધારમાં 34 મીમી, જેસરમાં27 મીમી, તળાજામાં 12 મીમી, ઘોઘામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર 9 મીમી અને ભાવનગરમાં 7 મીમી વરસાદ વરસ્યો છે.

> ભાવનગરમાં ત્રણ તણાયા જસદણમાં વીજળી પડતા બે બાળકના મોત

પાલિતાશામાં માતા એક્ટિવા લઈ સંતાનોને શાળાએ મુકવા જતાં પાણીમાં તણાયાં હતા જેમાં પુત્ર-પુત્રીનાં મોત તાલકાના ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર થયા હતા જ્યારે માતાનો બચાવ થયો થયો હતો. ઉપરાંત પાલિતાણા તાલુકાના થતા એક યુવકનું તણાઈ જવાને કારણે

63 મીમી, મહુવામા 36 મીમી, મોત નીપજ્યું હતું. જ્યારે જસદણનાં નવાગામમાં એક વાડીએથી બીજી વાડીએ જતા બે બાળકો પર વીજળી પડતા બંનેના મોત નીપજ્યા હતા.

મધ્યગુજરાતના પાંચ જિલ્લાના 31 તાલુકાઓમાં વરસાદ

વડોદરા સહિત મધ્યગુજરાતના પાંચ જિલ્લાઓના ૩૧ જેટલા તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. તેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. દાહોદ જિલ્લાના માધવા ગામે વીજળી પડતાં એક આધેડનું મોત નિપજ્યુ હતુ. વડોદરા આંકોલાળી પાસે કોઝવે પરથી પસાર શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં બે ઇંચથી

મોટોરોલા ચારુસેટમાં ગુજરાતનું સૌ પ્રથમ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર સ્થાપશે

» ચારુસેટ-મોટોરોલા વચ્ચે MOU પર હસ્તાક્ષર ભાવિ પેઢી માટે લાભદાયી: NRG ક્રિસ પટેલનો વતનપ્રેમ અને સમાજને પરત આપવાની ઉમદા ભાવના

નવગુજરાત સમય > ચાંગા

અમેરિકા સ્થિત મોટોરોલા સોલ્યુશન્સ કંપની ગુજરાતમાં સૌપ્રથમ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટરની ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) માં સ્થાપના કરશે. ચારસેટ કેમ્પસમાં યોજાયેલા સમારંભમાં ચારુસેટ-મોટોરોલા સોલ્યુશન્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર સ્થાપવા ચારુસેટ (એમ.ઓ.યુ.) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મોટોરોલાએ ગુજરાતમાં સ્થાપવા ચારૂસેટની પસંદગી કરી છે જે ઐતિહાસિક અને ગૌરવપ્રદ ઘટના છે.

MOU પર હસ્તાક્ષર કરવા મોટોરોલા



સોલ્યુશન્સ, ટેક્સાસ USAના યનિફાઇડ ડિરેક્ટર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર કોમ્યુનિકેશન્સના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ (કિશન) પટેલના નેતૃત્વ હેઠળ મોટોરોલા સોલ્યુશન્સ કંપનીના પદાધિકારીઓ સહિત ઉચ્ચસ્તરીય ડેલિગેશન ચારુસેટની મુલાકાતે આવ્યું હતું. ડેલિગેશનમાં ગોરા કુન્ડુ (સિનિયર ડિરેક્ટર), હાર્દિક કોઠારી (સિનિયર મેનેજર, હેન્ડસેટ, આર એન્ડ ડી), વસંત રાવ (સિનિયર મેનેજર, અને મોટોરોલા વચ્ચે સમજતીકરાર– ફાઇનાન્સ), પવન મલ્લાડી (મેનેજર, બિઝનેસ એનાલિટીક્સ એન્ડ રિપોર્ટિંગ) ઉલ્લેખનીય છે કે NRG ક્રિસ પટેલ મૂળ સૌપ્રથમ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર ચરોતરના વતની છે અને સમાજને પરત આપવાની ઉમદા ભાવના અને વતનપ્રેમ દર્શાવવા ચારુસેટમાં આ સેન્ટર શરૂ

છે જે કંપની હવે મોટોરોલાનો ભાગ છે.

ક્રિસ પટેલે વતનને, ખાસ કરીને ચરોતરને પાછું આપવાની ઈચ્છા દર્શાવવા માટે અને ઋણ અદા કરવા અમેરિકામાં મેટ્રોપોલિટન વોટર રિક્લેમેશન ડિસ્ટ્રિક્ટ ઓફ ગ્રેટર શિકાગોના સિનિયર એન્જિનિયર અને ચારુસેટ સાથે વર્ષોથી ગાઢપણે સંકળાયેલા સંજય પટેલ સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી હતી. સંજય પટેલે માર્ચમાં ચારુસેટના મેનેજમેન્ટનો સંપર્ક કરી આ બાબતે વાતચીત કરી હતી. ત્યારબાદ સંજય પટેલે ક્રિસ પટેલને ચારુસેટ વિશે વિગતવાર માહિતગાર કર્યા હતા અને ચારૂસેટમાં રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર સ્થાપવા ટાઈઅપ કરવા કરશે. ક્રિસ પટેલ KODIAKના સ્થાપક આમંત્રણ આપ્યું હતું.

રેલવે મઝદૂર સંઘના માહુરકરદાદાની પુણ્યતિથિએ વડોદરામાં રક્તદાન કેમ્પ



» પિતાના નામે એક માર્ગન નામ આપવાની ઈન્ફર્મેશન કમિશનર ઉદય માહરકરની માંગને સમર્થન આપતા વિધાનસભાના અધ્યક્ષ

નવગુજરાત સમય > વડોદરા

રેલવે શ્રમિકોની હક્ક માટેની લડાઈ લડનાર અને દાદાના હલામણા નામે જાણીતા સ્વ. જે.જી. માહુરકરની પ્રથમ પુષ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને સ્વ. જે. જી. માહુરકરના પુત્ર અને રાષ્ટ્રીય ઈન્ફર્મેશન કમિશનર ઉદય માહુરકરની પ્રેરક ઉપસ્થિતિમાં રેલવેના શ્રમિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને ધન્યતા

રાષ્ટ્રીય ઈન્ફર્મેશન કમિશનર ઉદય રેલવે મેનેજર અમીત ગુપ્તા, ચીફ મેડિકલ માહુરકરે પિતાના નામે વડોદરા શહેરમાં સુપ્રટેન્ડેન્ટ ડો. ક્રિષ્ણકુમાર, વેસ્ટર્ન રેલવે એક માર્ગનુ નામ આપવાની માંગને મઝદૂર સંઘના પ્રમુખ શરીફખાન પઠાણ સમર્થન આપતા ગુજરાત વિધાનસભાના સહિતના રેલવેના અધિકારીઓ ઉપસ્થિત અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે,

મોરબીમાં મિત્રોની વિકૃત

ચેષ્ટા: યુવકના શરીરમાં

નવગુજરાત સમય > મોરબી

કમ્પ્રેસરથી હવા ભરી દીધી

મોરબી નજીક આવેલી સીરામીક

ફેક્ટરીમાં રહેતા અને ત્યાં જ મજૂરી કામ

કરતાં મૂળ ઝારખંડના વતની અને બે

મહિના પહેલા જ મોરબીમાં સ્થાયી થયેલા

અબ્રાહમભાઈ કાંડેભાઈ ટૂટી (ઉ.વ.35)

નામનો શ્રમિક યુવાન આ ફેકટરીમાં

મજરી કામ કરતો હતો. તે વખતે તેની સાથે

કામ કરતા અન્ય મિત્રોએ મજાક મસ્તીમાં

આ શ્રમિક યુવાન સાથે વિકૃત ચેષ્ટાઓ

કરી હતી.મિત્રોએ વિકૃત હરકત કરીને આ

શ્રમિક યુવાનના પાછળના ભાગે ગુદામાં

કારખાનામાં રહેલા કંપ્રેશરના પાઈપથી

હવા ભરી દીધી હતી. આથી શરીરમાં

હવા ભરાવાથી શ્રમિક યુવાનનું પેટ ફુલાઈ

જતા તે મુશ્કેલીમાં મુકાઈ જતા તાબડતોબ

શ્રમિક યુવાનને રાજકોટ હોસ્પિટલમાં

સારવાર અર્થે ખસેડાયો હતો.

રેલવે શ્રમિકોની અને સામાજિક સેવા કરનાર તેમજ દેશહિતને પ્રાધન્ય આપનાર સ્વ. જે. જી. માહુરકરેના સ્મરણમાં વડોદરા શહેરમાં કોઈ માર્ગનુ નામ મળે તે માટે ભરપૂર પ્રયત્ન કરીશુ. દેશહિતને વરેલા સ્વ. જે.જી. માહુરકરે ૫૦ વર્ષ સુધી કર્તવ્યપરાયણતા, પ્રમાણિકતા, સખત પરિશ્રમ કરીને રેલવે ટ્રેડ યુનિયનની સેવા કરી છે. આ માટે મહારાષ્ટ્ર સરકારે સાવિત્રીબાઈ ફૂલે જેવો એવોર્ડ આપી તેમને સન્માનિત કર્યા હતા. ઉપરાંત તેમની સેવાની નોંધ લઈને દ્રોણાચાર્ય એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે. તેમની

યોજીને તેમને ઉચિત શ્રધ્ધાંજલિ અર્પી છે. ભારતના ઈન્ફર્મેશન કમિશનર ઉદય માહુરકરે જણાવ્યુ કે, મારા પિતાએ રેલવે શ્રમિકોની ખૂબ સેવા કરી છે, સતત તેમના હક્ક માટે લડાઈ લડતા રહ્યા. દેશહિત અને રેલવેના કર્મચારીઓ હિતને અલગ મુકામ સ્વ. જે. જી. માહુરકરના પુત્ર અને પર લઈ ગયા હતા. આ પ્રસંગે ડિવિઝનલ

આ પ્રથમ પુરુયતિથિએ રક્તદાન કેમ્પ

સયાજી હોસ્પિ .ના नर्सनी राष्ट्रीय કक्षाना ફ્લોરેન્સ नाઇटिंગेલ એવોર્ડ માટે પસંદગી

નવગુજરાત સમય > વડોદરા

વડોદરાની સયાજી હોસ્પિટલ અને ખાસ કરીને સ્ત્રીરોગ અને પ્રસૃતિ વિભાગમાં



તેમનું આખું નામ ભાનુમતી સોમાભાઈ ઘીવાલા છે. ભારતીય ઉપચર્યા પરિષદ એટલે કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલે નર્સિંગ ના ક્ષેત્રમાં પદમશ્રી ગણાય તેવા,૨૦૨૦ ના ફ્લોરેન્સ નાઇટિંગેલ રાષ્ટ્રીય એવોર્ડ માટે તેમની પસંદગી કરી છે.નર્સિંગ પ્રોફેશન ના આદ્ય સ્થપાક ગણાય તેવા અને જેમને આખી દુનિયા દયાની દેવી કે લેડી વિથ ધી લેમ્પ ના નામે ઓળખે છે તેવા ફ્લોરેન્સ નાઈટિંગેલનું નામ જેની સાથે જોડાયેલં છે તેવો આ એવોર્ડ કરુણા અને માનવતા,સહૃદયતા અને સંવેદનાથી મઘમઘતી સમર્પિત દર્દી સેવા માટે આપવામાં આવે છે. તેની

ભાનુબેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગની તાલીમ પરી કરીને રાજ્યની આરોગ્ય સેવામાં રાપર થી કારકિર્દી શરૂ કરી હતી. તે પછી પાલનપુર અને ૨૦૦૦ ની સાલ થી વડોદરામાં સેવા આપી રહ્યાં છે.

પસંદગી રાષ્ટ્રીય સ્તરે થાય છે.

માળિયાના લાડુડી ગીરમાં નદીએ કપડાં ધોતી મહિલાને મગરે ફાડી ખાધી

» નદીમાં પાંજરા ગોઠવી મગરને કેદ કરાઈ

નવગુજરાત સમય > જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના લાડુડી ગીર ગામે નદી કાંઠે કપડા ધોઈ રહેલી મહિલા પર અચાનક મગરે હુમલો કર્યો હતો. જેથી મહિલાને ગંભીર ઈજા પહોંચતા કરૂણ મોત નિપજયું હતું. જેના પગલે નાના એવા લાડુડી ગીર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ ઘટનાની જાણ કરાતા હતી. વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મગરને પકડવા રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં

કરી લેવાતા ગ્રામજનોએ હાશકારો

અનુભવ્યો હતો.

માળીયાહાટીના તાલુકાના લાડુડી ગીર ગામે આજે બુધવારે બપોરેના અરસામાં ગામની સીમ વિસ્તારમાં નામની મહિલા મગરના હુમલાનો પ્રસરી હતી. ભોગ બની હતી. આ મહિલાને ઝડબામાં પકડી મગર નદીમાં ખેંચી ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ

કરતા મહિલાનું મૃત્યુ થયું હતું. આ બનાવને પગલે વાઇલ્ડ લાઈફ રેન્જ માળીયાહાટીના આરએફઓ અમીન સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બનાવની વિગતો સ્થાનિકો પાસેથી

જાણી હુમલાખોર મગરને પકડવા

તપાસ હાથ ધરી હતી. વન વિભાગના નિયમ મુજબ મૃતક મહિલાના પરિવારને વન્યપ્રાણીથી મોત અને ઈજાના બનાવ બાબતે મળતું વળતર ચુકવવા માટે કાર્યવાહી હાથ ધરી

બીજી તરફ હુમલાખોર મગરને કેદ કરવા માટે આરએફઓ એ.કે. અમીનની સુચનાથી 10 જેટલા સ્ટાફ મોડીરાત્રે હુમલાખોર મગરને કેદ કર્મીઓએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ઘટનાસ્થળની નજીક નદીમાં ચાર પાંજરા ગોઠવી મુક્યા હતા.

મોડીરાત્રે વનકર્મીઓની ભારે જહેમત અને મહેનત બાદ નદીમાં મકાયેલા ચાર પૈકી એક પાંજરામાં વહેતી આંબકઈ નદી પર આવેલા હમલાખોર મગર કેદ થઈ હતી. ચેકડેમ પર મહિલાઓ કપડાં ધોઈ બાદમાં કેદ કરાયેલા મગરને રહી હતી. તે સમયે નદીમાં રહેલો સાસણ ગીરની વન્યપ્રાણીઓની મહાકાય ખુંખાર મગરે અચાનક હોસ્પીટલ ખાતે મોકલવામાં આવી હુમલો કર્યો હતો. જેમાં ગીતાબેન છે. નદીમાંથી હુમલાખોર મગર કેદ રાજભાઈ વાઢીયા (ઉ.વ.47) થતા ગ્રામજનોમાં રાહતની લાગણી

સાણંદ તા.પં.ના R.O. કૌભાંડમાં તત્કાલીન ટીડીઓ અને મહિલા એન્જિનિયર સસ્પેન્ડ

» એક કરોડના કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે પગલાં લેવાયાં

નવગુજરાત સમય > સાણંદ

સાશંદ તાલુકાની ૪૨ પ્રાથમિક શાળાઓમાં એક કરોડના ખર્ચે મંજૂર થયેલા આર.ઓ પ્લાન્ટ નાંખવાના બદલે પીપડા મુકીને આચરેલા કૌભાંડે રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. બહુચર્ચિત આર.ઓ.કૌભાંડમાં બે મહિના ઉપરાંતની તપાસ બાદ અમદાવાદ ડીડીઓએ અંતે તત્કાલીન ટીડીઓ અને તાલુકા પંચાયતના મહિલા મદદનીશ ઇજનેરને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

૨૭ એપ્રિલ ૨૦૨૧ના રોજ સાણંદ તાલુકા પંચાયતની કારોબારી સભામાં તાલુકાની ૪૨ ગામની પ્રાથમિક શાળામાં એક કરોડના ખર્ચે વોટર પ્યુરિફાયર અને આર.ઓ.પ્લાન્ટ નાંખવાના કામને બહાલી આપવામાં આવી હતી. આ કામ સાણંદની શ્રીરામ મંડળીના હસુભાઇ પટેલને સોંપાયું હતું. આ કોન્ટ્રાક્ટરે તમામ શાળાઓમાં આર.ઓ પ્લાન્ટને બદલે ૪૦૦ની કિંમતનું પીપડું મુકીને મંડળીના નામે નાણાં ઉપાડી લીધા હતા. શાળાઓમાં આર.ઓ.પ્લાન્ટ મંજુર થયાની જાણ થતાં સ્કૂલના

કૌભાંડમાં સંડાવાયેલા કોન્ટાક્ટરને છાવરાયા સાણંદ તાલુકા પંચાયતના મોટભાગના સરકારી કામનો કોન્ટ્રાક્ટ રાખતી

શ્રી રામ મડળીના કોન્ટ્રાક્ટર હસમુખ પટેલે અધિકારીઓ સાથે મળીને ૪૨ શાળાઓમાં આર.ઓ.પ્લાન્ટ નાંખવાના બદલે પીપળા મુકીને એક કરોડનું કૌભાંડ આચર્ચુ હતુ. આ મંડળીએ તાલુકામાં સ્ટ્રીટલાઇટોથી લઇને અનેક કામોમાં ગેરરિતી આચરી હોવાની વ્યાપક ફરિયાદો મળી છે છતાં હજુ સુધી ડીડીઓએ માત્ર સરકારી અધિકારીઓ સામે જ પગલાં લઇને સંતોષ માન્થો છે. જો કે એક કરોડના કૌભાંડમાં સંડોવાયેલી આ મંડળીના કોન્ટ્રાક્ટર સામે કેમ કોઇ પગલાં લેવાચા નથી તેવો વિપક્ષ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે.

શિક્ષકોએ આ સમગ્ર કૌભાંડ બહાર સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. પાશ્રું હતું. આ કૌભાંડમાં ડીડીઓએ

ટીડીઓ,મદદનીશ કાર્યપાલક ઇજનેર, તત્કાલિન ટીડીઓ, અને ટીપીઇઓ પાસેથી તપાસના અહેવાલો મંગાવ્યાં હતા. જો કે તપાસ દરમિયાન જ શ્રી રામ મંડળીએ રાતોરાત તમામ સ્કુલોમાં આર.ઓ. પ્લાન્ટ ફીટ કરીને કૌભાંડને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. પરંત બે મહિનાની તપાસ બાદ ડીડીઓ અનીલ ધામેલિયાએ વર્કઓર્ડર સહિત બીલ મંજર કરવામાં જવાબદાર તત્કાલિન ટીડીઓ તેમજ તાલુકા પંચાયતના મદદનીશ ઇજનેર મનીષાબેન પટેલને

NAME RAMA PUNJA, AND MOTHER NAME IS SONA BAI, CHANGE OF NAME AND SPELLS AS "MAHESH RAMA SIKOTARIYA, FATHER NAME RAMA PUNJA AND MOTHER NAME SONABAI RAMA" INSTEAD OF OUR PREVIOUS NAME MAHESH RAMA SIKOTARIYA, FATHER NAME RAMA PUNJA, AND MOTHER NAME IS SONABAI RAMA.

CHANGE OF NAME

ADDRESS: MUKESH CARSANE, HOUSE NO.1375, KHARVA WADA, VANAKBARA, DIU,362570. (U.T.)OF DAMAN AND DIU.



ટુંકી જાહેર નિવિદા: ૧૬/૨૦૨૧-૨૨ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (ગુજરાત સરકાર સ્થાપિત ઉપક્રમ)



le 5205

રૂ. 900/-+ રૂ. ૧૦૮ (જી.એસ.ટી. ૧૮%) = રૂ. ૭૦૮/-

સેક્ટર-૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૭. ફોન નં. ૨૩૨૫૦૬૩૨, ૨૪ થી ૨૩૨૫૦૬૩૭ ફેક્સ નં.: ૨૩૨૫૦૭૦૭ (૧) નિગમની ઉદ્યોગ ભવત, ગાંધીનગર, ખાતેની વડી કરોરીએ ફીટ કરેલા ર નંગ પ કેવીએ અને ૮ નંગ ૧૦ કેવીએ યુપીએસ સર્વર એક્મ સાથે જોડાયેલ સતત વીજ પુરવઠો માટે તમામ પ્રકારની સામગ્રી

સિવાયની સાથે મરામત કામના વાર્ષિક કરાર બાબતે અનુભવી ઈજારદાર પાસેથી સીલ બંધ કવરમાં રેન્ડરો મંગાવવા ભાગત આ કામોની અંદાજીત રકમ અનુક્રમે 3.9,36,900/- 8. ઈ.એમ.ડી.ની રકમ 3.9362/-

આ અંગેના કોરા ટેન્ડરો ઈશ્યુ કરવાની છેલ્લી તારીખઃ ૦૯/૦૯/૨૦૨૧ થી ૧૮/૦૯/૨૦૨૧ (સ્જાના દિવસો સિવાય) સુધી રાવારે ૧૧.૦૦ થી ૧૫.૩૦ કલાક દરમ્યાન .

માવ બરેલ ટેન્ડરો સ્વીકારવાની છેલ્લી તા. ૨૧/૦૯/૨૦૨૧ ના રોજ ૧૮.૦૦ કલાક સુધીની રહેશે.

ભાવ ભરેલ ટેન્ડરો ખોલવાની છેલ્લી તા. ૨૨/૦૯/૨૦૨૧ ના રોજ ૧૨.૦૦ કલાકે રહેણે અનુ . નં . ૧ ટેન્ડર માટેનાં જરૂરી દસ્તાવેજો જેવા કે , જી .એસ .ટી . રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર , ઈ.પી .એફ .ઓ .નું અનુ. ન . ૧ ટન્ડર માટના જરત સ્ટતારના જવા કે, જી.અત ટો. જીન્ટ્રણ માનાવાત્ર, ઇ.વા.અફ.આ.તુ માન્ય રજીસ્ટ્રેશન અને અદ્યત્વ ચલણ, અ) ઇ-ર કશાનું ઇતિક્ટ્રીકલ વીંગ રજીસ્ટ્રેશન અને ઇજેરદાર તરીકેનું માન્ય લાઇશન્સ અને બ) યુપીએસ એકમો માટે મૂળ ઉતપાદક ઉપકરણે (OEM) પારોથી વેચાણ/રોવા પ્રદાત માટે અધિકૃતતાનો પત્ર અથવા OEM ની અધિકૃત પ્રદાતાની પેટા વેચાણ/રોવા પ્રદાતાનો પત્ર, પાનકાર્ક, અધ્યત્વન આવકવેશ રીટર્ન, વાર્ષિક રૂ.૧,૩૯,૧૮૦/- કે તેથી વધુ ટર્નઓવરનું પાછલા પાંચ પાંચ વર્ષનું સી.એ. સર્ટોકિક્ટ તથા આવા જ કામના ઓછામાં ઓછા પ વર્ષના સમાના પ્રકારના કામનો અનુભવના પુરાવા જેમાંથી

રિટાકાર્ક્સ દ્વારા બાંગા જ કામલા આક્યા આઠ મે વધાના સમાનું કારાલા કામલા બાંગા અનુવારા કામલા એવું જ કામ કે જેની રકમ રૂ. ૧,૧૧,૩૪૪/- જેટલી આથવા બે એવું જ કામ કે જેની રકમ રૂ. ૧૯,૫૯૦/-અથવા ત્રણ એવું જ કામ કે જેની રકમ રૂ. ૧૫,૬૦૨/- જેટલી તેનાથી વધુ હોવી જોઈએ. તેમજ રૂ. ૨૭,૮૩૧/-કે તેથી વધુની ચાલુ વર્ષની રાષ્ટ્રીચકૃત બેંકની સોલવન્સી રજુ કર્યેથી અધિક્ષક ઇજનેરશ્રી (ચાં/વિ) ની ઉક્ત રથળે આવેલ કચેરીએથી આપવામાં આવશે. ઉકત ટેન્ડરો ફકત રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટથી સીલબંધ કવરમાં જ સ્વીકારવામાં આવશે. વધુ માહિતી માટે

વેબસાઇટ www.gidc.gov.in અને www.statetender.com પરથી તેમજ ઉપરોક્ત સરનામે કચેરીને

માહિતી/૧૦૪૯/૨૧-૨૨

अधिक्ष**ड र्ग**डनेर (यां/वि)

છ કિલો ગાંજાના છોડ સાથે અમદાવાદની બે મહિલા કરજણથી ઝડપાઇ

નવગુજરાત સમય > વડોદરા

વડોદરાના કરજણ નજીક ટોલનાકા પાસે પોલીસ ચેકિંગમાં હતી ત્યારે બે મહિલાઓએ વાહનમાંથી નીચે ઉતરી જઇને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે તેઓનો પીછો કરીને બંન્નેની અટકાયત કરી હતી.તપાસ કરતાં બંન્ને પાસેથી ૬.૧૪૭ કિલોગ્રામ ગાંજો આવ્યો હતો. ૬૧૪૭૦ના આ મુદ્દામાલ સાથે કમળાબેન વિનોદભાઇ પરમાર (ઉ.૩૫) તથા ડોલીબેન ઉર્ફે લીલાબેને હરેશભાઇ પરમાર રહે. ગણેશનગર, વુડાના મકાનમાં, ભાઠા ગામ, વાસણા, અમદાવાદ હોવાનું બહાર આવ્યુ હતુ.

Par Drugs And Chemicals Limited (Erstwhile Par Drugs And Chemicals Private Limited) CIN: L24117GJ1999PLC035512

Registered office: 815, Nilamber Triumph, Gotri Vasna Road, Vadodara-390007, Gujarat, India Phone no.: 0265-2991021, 0278-2447013

Website: www.pardrugs.com Email: investors@pardrugs.com

NOTICE OF 22nd ANNUAL GENERAL MEETING & E-VOTING INFROMATION

Notice is hereby given that the 22nd Annual General Meeting (AGM) of the Company will be held on Wednesday, 29th Day of September, 2021 at 4:00 P.M IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the business, asset out in the Notice of AGM. The Company has sent the AGM Notice & Annual Report on September 6, 2021through electronic mode to the members whose email addresses are registered with the Company/Depositories/Share Transfer Agent in accordance with circular issued by Ministry of Corporate Affairs, dated May 5, 2020; dated April 8, 2020; dated April 13, 2020 [Collectively hereinafter referred as "MCA Circulars"] and SEBI Circular dated May 12, 2020. The Annual Report with AGM notice can be downloaded from the Company's website www.pardrugs.com, website of the National Stock Exchange of India Limited at www.nseindia.com and website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com

Pursuant to provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations 2015, the members are provided electronic Voting ["e-voting"] facility provided by NSDL before and during the AGM according to schedule given in the notice of AGM to cast their votes on all resolutions set out in the Notice of the AGM. The voting rights of the members shall be in proportion to equity shares held by them in the paid up equity share capital of Company as on Tuesday, September 21,

The remote e-voting period begins on Friday, September 24, 2021 at 09:00 A.M. IST and ends on Tuesday, September 28, 2021 at 05:00 P.M. IST. during this period shareholders of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e on Tuesday, September 21, 2021 may cast their vote electronically. The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. Only those shareholders, who are present in the AGM through VC/OAVM facility and have not casted their vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system available during the AGM. The Shareholders who have voted through Remote e-Votingprior to AGM, may attend/participate but they will not be entitled to vote during

Any person, who acquires shares and becomes member of the company after dispatch of AGM notice and hold shares as on cut-off date; may obtain the credentials by sending a request to evoting@nsdl.co.in However, if he/she is already registered with NSDL for remote e-voting, then he/she can use the existing credentials forcasting votes.

Further, if you have not registered your email address with the Company/Depositories/Share Transfer Agent, you may follow the instructions given in the AGM Notice. In case, any member have any queries regarding e-voting can refer instruction of e-voting

mentioned in AGM Notice of the Company. Though, Individual Shareholders holding securities in demat mode facing any technical issues related to login through Depository i.e. NSDL and CDSL, can contact :-(i) NSDL helpdesk by sending a request at evoting@nsdl.co.in or call at toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 And; (ii) CDSL helpdesk by sending a request at helpdesk.evoting@cdslindia.com or contact at 022- 23058738 or 022-23058542-43

The details of AGM are available on website of company at www.pardrugs.com; website of NSDL at evoting@nsdl.co.in and website of NSE at www.nseindia.com.

Date: 09/09/2021 Place: Vadodara

For Par Drugs And Chemicals Limited Sanket B. Trivedi Company Secretary & Compliance Officer

East Zone-Engineering Department E Tender Notice No. 9/2021-22

AHMEDABAD MUNICIPAL CORPORATION

Date of Submission:-29.09.2021 Time 6:00 pm Last Date of 30.09.2021 Time 4:00 pm Physical Submission:-

Opening Date:-30.09.2021 Time 5:00 pm Details and Tender available on www.amcnprocure.com

CIN: L17110GJ2000PLC037369



VERA SYNTHETIC LIMITED

Regd. Office: Office No. UL-27, Pattani Plaza, Devubaug, Dairy Road, Bhavnagar GJ 364002 IN Phone No .: +91 0278 2525434 Email ID: cs@sujlonropes.com Website: www.sujlonropes.com

NOTICE OF 22nd AGM AND BOOK CLOSURE Notice is hereby given that the 22nd Annual General Meeting of the Members of Vera Synthetic Limited is scheduled to be held on Thursday, the 30th Day of September 2021 at 11:00 A.M.at Office No. UL-27, Pattani Plaza

The 22nd Annual General Meeting of the Company will be held in compliance with the provisions of the Companies Act 2013 and rules made thereunder, Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015 and circular number SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12.05.2020 issued by SEBI and covid-19 guidelines issued by the Government of India.

Devubaug, Dairy Road, Bhavnagar GJ 364002 IN.

In terms of above mentioned circular, Companies are permitted to dispatch the Notice of the AGM along with the Annual Report FY 2020-21 through electronic mode to all the members whose email addresses are registered with the company/Depositaries. The same is available on the Company's website at https://www.sujlonropes.com/ The notice can also be accessed from the website of stock exchange i.e. National Stock Exchange of India Limited at www.nseindia.com

Notice is further given that pursuant to the provisions of the Section 91 of the Companies Act, 2013 and in accordance with the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members & Share Transfe Books of the Company will remain closed from Thursday 23.09.2021 to Thursday 30.09.2021 (both days inclusive) for the purpose of 22nd AGM.

A member can vote at the AGM. Persons entitled to attend and vote at the meeting, may vote in person or by proxy/ through authorized representative, provided that all proxies in the prescribed form/ authorization duly signed by the person entitled to attend and vote at the meeting are deposited at the Registered office of the Company, not later than 48 hours

For, Vera Synthetic Limited Place: Bhavnagar Kruti Shah Date: 07.09.2021 **Company Secretary**

ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડીકલ એજ્યુકેશનલ કોર્ષીસ, ગુજરાત સરકાર ઓફીસઃ જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, ગાંધીનગર શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ વર્ષ ફીજીઓથેરાપી, બી.એસ.સી. નર્સિંગ, જી.એન.એમ..

એ એન એમ., નેચરોપેથી, ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ, ઓપ્ટમેટ્રિ અને ઓક્યુપેશનલથેરાર્પ અભ્યાસક્રમો માટે ઓનલાઈન પીન વિતરણ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એકઝામિનેશન બોર્ડ, કેમ્બ્રિજ ઈન્ટરનેશનલ બોર્ડ અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગની ગુજરાત રાજ્યમાં આવેલ સ્કુલોમાંથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ ના ધોરણ-૧૨ અને અગાઉના વર્ષોમાં બોર્ડ દ્વારા (વિજ્ઞાન પ્રવાહ , સામાન્ય પ્રવાહ , ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ) લેવાયેલ પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ , યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત રાજ્યમાં આવેલ સરકારી/કામદાર રાજ્ય વિમા નિગમ/મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સ્વનિર્ભર સંસ્થાઓની સરકારી બેઠકો માટે પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના પીન વિતરણ ઓનલાઈન રજીસ્ટેશન તથા ડોક્યમેન્ટ ચકાસણીનો કાર્યક્રમ નીચે પ્રમાણે યોજવામાં આવશે.

SH	0	तारीज अने समय		
34	વિગત	થી	સુધી	
۹.	પ્રવેશ સમિતીની વેબસાઇટ પરથી ઓનલાઇન	९३/०६/२९	૨૭/૦૯/૨૧	
	પીન ખરીદી	सवारना १९.०० थी	સાંજે ૨.૦૦ સુધી	
₹.	ઓનલાઇન રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રો	૧૩/૦૯/૨૧	૨૭/૦૯/૨૧	
	અપલોડ માટે	બપોરના ૧૨.૦૦ થી	સાંજે ૪.૦૦ સુધી	
3.	હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ	૧૪/૦૯/૨૧	૨૮/૦૯/૨૧	
	પ્રમાણપત્રોની નકલ જમા કરાવવા માટે	બપોરના ૧૨.૦૦ થી	સાંજે ૦૪.૦૦ સુધી	

ओनलार्धन पीन प्रवेश सभितिनी वेजसार्धर www.medadmgujarat.org पर मांगेल प्राथमिङ माहिती पूरी पाड्या जाह ₹ २००/- (नोन रीईडेजल) नी ओनलार्धन युडवशी ड्यां पछी तमार

રજીસ્ટર મોબાઈલમાં USER ID અને PIN મોકલવામાં આવશે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે. ઈન્ટરનેટ સુવિધા ન ધરાવતા ઉમેદવાર કોઇપણ ચાર્જ ભર્યા વિના પ્રવેશ સમિતિ દ્વારા નિયુક્ત સાઈબર સેન્ટર (સૂચી પ્રવેશ સમિતિની વેબસાઇટ પર ઉપલબ્ધ છે) ઉપર રજીસ્ટ્રેશનની સુવિધા મેળવી શકશે.

ઉમેદવારે પ્રવેશ સામિતિની વેબસાઇટ <u>www.medadmgujarat.org</u> પર લોગ ઇન કરી રજીરટ્રેશનની પાર્ટ-૧ની પ્રક્રિયા અને પાર્ટ-૨ માટે સંબંધિત પ્રમાણપત્રો અપલોડ કરી અસલ પ્રમાણપત્રો રૂબરૂ <u>હેલ્</u>ય <u>સેન્ટર ખાતે કરજિયાત</u> કરાવવાની રહેશે. (અસલ પ્રમાણપત્રો હેલ્પ સેન્ટર ખાતે જમા કરાવાની નથી) ત્યારબાદ જ રજીરદ્રેશન પ્રક્રિયા પૂર્ણ ગણવામાં આવશે .

તમામ પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો , તેમના વાલીઓ અને તમામ અન્ય સંલગ્ન વ્યક્તિઓએ પ્રવેશ પ્રક્રિયા અંગેની રોજબરોજની માહિતી સમયાંતરે પ્રવેશ સમિતિની વેબસાઈટ www.medadmgujarat.org ની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.